

Oil & Gas Field Services

November 06, 2023

To,
Corporate Relations Department
BSE Limited
2nd Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai – 400 001

To,
Corporate Relations Department
National Stock Exchange of India Limited.
Exchange Plaza, Plot No. C-1, Block-G,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai – 400 051.

SCRIP CODE: 543288

SYMBOL: DEEPIND

Sub.: Newspaper Publication of Financial Results - Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

In compliance with Regulation 47 and other applicable provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copy of newspapers advertisement published on Saturday, November 04, 2023 in Business Standard (English) and Jai Hind (Gujarati) editions wherein the Unaudited standalone and consolidated Financial Results of the Company for the quarter and half year ended September 30, 2023 as approved by the Board of Directors of the Company at its meeting held on Thursday, November 02, 2023 have been published.

This intimation will also be uploaded on the Company's website at www.deepindustries.com.

You are requested to take the same on your record.

Thanking You,

Yours faithfully,

For, Deep Industries Limited

Shilpa Sharma

Company Secretary & Compliance Officer

GUJARA

M.No: A34516

Encl.: a/a





Regd.Off.: 12A & 14 Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad-380058
Tel: +91 2717 298510 M: +91 98256 00533 Fax: +91 2717 298520
Email: info@deepindustries.com Website: www.deepindustries.com
CIN: L14292GJ2006PLC049371





Pranch Office: ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007.

PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

Sr. No.		Name of Details of the Secured asset(s) Co-Borrowers/ with known encumbrances, if any Loan Account No.		Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
l	(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
	1.	Rajubhai I Chauhan (Borrower)/ Meenaben R Chauhan (Co-Borrower) Loan A/c No. LBBRD00003083596/ LBBRD00003083443	Flat No. 501, 5th Floor, Veer Residency, Revenue Survey No.315, Plot 22, C.S. No. 2125 and 2125/1, Goyagate Co-operative Housing Society, R. V. Desai Road, Pratap Nagar, Village Kasba, Vadodara-390001. Admeasuring an area of 1073 Sq. Ft. Free Hold Properly.	Rs. 33,39,761/- (as on October 31, 2023)	Rs. 24,00,000/- Rs. 2,40,000/-	December 01, 2023 From 11:00 AM To 12:00 Noon	December 12, 2023 From 11:00 AM Onwards

LBBRD00033083448 | Not Property.

The online auction will take place on the website of e-auction agency agency agency Mis Nexxen Solutions Private Limited (URL Link-thips://disposalhub.com). The Mortgagors' noticee are given a last chance to pay the total dues with further interest till December 11, 2023 before 04:00 PM else this secured asset will be sold as per schedule.

The Prospective Bidder(s) must sount the Earnest Minery Deposit (EMD) Demand Draft (nb) [Refer Column E] at ICICI Bank The Prospective Bidder(s) and sount the Earnest Minery Deposit (EMD) Demand Draft (nb) (Refer Column E) at ICICI Bank The Prospective Bidder(s) and sound the Earnest Minery Deposit (EMD) Demand Draft (nb) error of the Prospective Bidder(s) are unable to submit their offer through the above mentioned vebsite only on chefore December 11, 2023 before 04:00 PM along with scan image of Bank acknowledged DD towards proof of payment of EMD Kindly note, in case prospective bidder(s) are unable to submit their offer through the website then signed copy of tender documents may be submitted at ICICI Bank Towers, Near Chalici ICICe, (olf Padra Road, Vadodara-390007 on chefore December 11, 2023 before 05:00 PM East Money Deposit DD/PO should be from a Nationalised/Scheduled Bank infavour of "ICICI Bank Limited" payable at Vadodara. For any further califications with regards to inspection, terms and conditions of the e-auction or submission of tenders, kindly contact ICICI Bank Limited on 730491423777573024297.

Please note that Markeling agencies I.Ms Noxxen Solutions Private Limited 2. Augeo Assets Management Private Limited have also been engaged for facilitating the sale of this property.

Please note that Markeling agencies I.Ms Noxxen Solutions Private Limited 2. Augeo Assets Management Private Limited have also been engaged for facilitating the sale of this property.

Date: November 04, 2023 Place: Vadodara



DEEP INDUSTRIES LIMITED

Regi. Office: 12 A &14, Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058. Ph: 02717-298510 Fax: 02717-298520 Email: cs@deepindustries.com www.deepindustries.com CIN:114292G12006PLC049371

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER & HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2023 (₹ In Lakhs)

Sr.		Quarter Ended		Quarter Ended
No.	ALL SALES SALES AND PARTY OF THE SALES	30.09.2023	30.09.2023	30.09.2022
	(Refer Notes below)	Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operations (net)	11,098.22	21,790.72	6,848.33
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,793.64	7,587.83	1,417.31
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,793.64	7,689.33	1,417.31
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,952.33	6,053.99	860.22
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)	3,111.14	6,229.10	1,655.27
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]			
6	Equity Share Capital (Face Value of ₹. 10/- Per Share)	3,200.00	3,200.00	3,200.00
	Other Equity			
7	Earning per share of ₹. 10/- each			
	(from Continuing and Discontinuing Operations)			
	Basic (in ₹.)	4.61	9.46	1.34
	Diluted (in ₹.)	4.61	9.46	1.34
	KEY NUMBERS OF STANDALONE FINANCIAL RESULTS			
1	Total Income from Operations (net)	9,577.93	19,031.66	7,030.74
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,205.09	6,360.04	2,276.46
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	2,398.43	4,759.35	1,721.40

- The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the quarter and half Year ended September 30, 2023 are available on the Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (http://www.deepindustries.com).
- (http://www.deepindustries.com).
 The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on November 02, 2023. The statutory auditors of the company have carried out audit of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015
- $Figures \ of previous \ reporting \ periods \ have \ been \ regrouped/reclassified \ wherever \ necessary \ to \ correspond \ with \ the figures \ of the \ current \ reporting \ period.$

PARAS SAVLA Place : Ahmedabad Chairman & Mar /Janaging Director (DIN: 00145639)

Date: 02-11-2023

60 Days Notice to Borrower

पंजाब লীছালল बींक Circle Sastra, 6th Floor, Gujarat Bhavan, Ellisbridge, punjobnotionol bonk Ahmedabad • 380006. Ph.: 079-26578602-03, Mail: cs4517@pnb.co.in

Date: 06.10.2023

Mr. Harshadji Manuji Thakor

ws, Khalkashpir Road, Nr. Railway Fatak, Patan, Gujarat - 384265.

Dear Sir/Madam,
NOTICE UNDER SECTION 13(2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY
INTEREST ACT 2002 (SARFAESI)
Reg: NPA Account No. 670200NC00000206 & 6702009900000038 Credit, facility availed by Sh. Harshadji Manuji Thakor.
You, Sh. Harshadji Manuji Thakor having regd. Add. at: H No. 22, Jay Bungalows, Khalkashpir Road, Nr. Railway Fatak, Patan - 384265, Gujarat. have availed the following credit facilities from BO: Patan.

availed the folia	availed the following dream admitted from Bo. 1 attain.							
Credit Facility Sanctioned	Availed Limit with Account No.	Rate of Int. at the time of Section	Prevailing rate of Int.	Balance O/S as on i.e. 02.11.2022	Interest (w.e.f. 02.11.2022 to 05.10.2023)	Other Charges	Recovery after NPA	Total Outstanding as on date 05.10.2023
Housing Loan	Rs. 12,00,000.00 670200NC00000206	10.00%	9.50%	Rs. 10,80,647.37	Rs. 95,773.67	Rs. 9.24	Rs. 7,931.58	Rs. 11,68,498.70
Housing Loan Overdraft	Rs. 6,00,000.00 6702009900000038	9.85%	9.15%	Rs. 5,99,174.24	Rs. 53,501.76	Rs. 0.00	Rs. 230.53	Rs. 6,52,445.47
Total	Pe 18 00 000 00			Re 16 79 821 61	Re 1 49 275 43	Re 9 24	Re 8 162 11	Re 18 20 944 17

rotal Rs. 18,00,000.00 Rs. 18,00,000.00 Rs. 16,79,821.61 Rs. 1,49,275.43 Rs. 9.24 Rs. 8,162.11 Rs. 18,20,944.1
That you all are the borrowers in view of the definition provided under Section 2(f) of the SARFAESIACt, 2002.
That the undersign is the authorised officer in view of the definition provided under Rule 2(g) of the SARFAESIACt, 2002.
Due to non-payment of installment / interest / principal debt, the accounts has have been classified as Non-Performing Asset on 02.11.2022 as per Reserve Bank of indiaguidelines. We recalled the entire undstanding together with interest and other charges deu under the above facilities.
The amount due to the Bank as on 05.10.2023 of Rs. 18,20,944.17 (Rupees Eighteen Lakhs Twenty Thousand Nine Hundred Forty Four and Paiss Seventeen Only with future interest until payment in full, (herinafter referred to as "secured debt"). To secure the outstanding under the above salidities.

Facility

ı	r aronney	0200
I	Housing Loan 670200NC 00000206	Primary Security: Registered Mortgage of House thereof at Samalpati R.S. No. 960/3, House No. 22, Jay Bungalows House, Total Sq. Mtrs. 93.87 situated at Samalpati-Patan, of Patan City. Bounded by: East: As per Layout Plan House No. 23 Come, West: As per layout
I	Overdraft Facility on HL 6702009900000038	Plan House No. 21 Come, North: As per layout Plan Own House Margin Land after R.S. No. 960 Paiki Lane Come, South: Wide Internal Road Come. (Owner: Harshadji Manuji Thakor)

670200990000038

Road Come, Owner Harbanagh inanyu in axory
We hereby call upon to you gay the amount of Rs. 18.20.944.17 (Rupses Eighteen Lakhs Twenty Thousand Nine Hundred Forty Four and Paiss Seventeen
Only as on 65.10.2033 with future interest and charges at the contracted rate until payment in full within 60 days (sixty days) from the date of this notice, in default,
besides exercising other rights of the flack as available under Law, the Bank is intending to exercise any or all of the powers as provided under section 13(4) of the
SARFAESI Act 2002, (hereinafter referred to as 'the Act') The details of the secured dastes intending to exercise any or all of the powers as provided under section 13(4) of the Sare Rest. (As 2002, the reinafter referred to as 'the Act') The details of the secured dastes intended to be enforced by the Bank, in the event of the non-payment of secured date) is given above.

Your attention is hereby drawn invited to provisions of sub-section(8) of section 13 of the Act in respect of time available to your demanded to the scured assets. Please take notice that in terms of section 13(13) of the said Act, you shall not, after receipt of this notice, transfer by way of sale, lease or otherwise (other than in the ordinary course of business) any of the secured assets as bove referred to, without prior written consent of the Bank. You are also put on notice that any contravention of this statutory injunction/restraint, as provided under the said Act, is anofferor.

If you represent the secured assets are old or leased out in the ordinary course of business, the sale proceeds or income realised shall be deposited/remitted with to the If or any review of the secured assets are old or leased out in the ordinary course of business, the sale proceeds or income realised shall be deposited/remitted with to the If or any review of the secured assets are old or leased out in the ordinary course of business, the sale proceeds or income realised shall be deposited/remitted with to the If or any rev

Prease comply with mis demand under mis notice and avoid all unpassantness, in case of non-compliance, jurner needual all costs and consequences.

*This notice is issued without prejudice to the bank taking legal action DRT /Court, as the case may be
*This notice issued without prejudice to the bank's rights in the suitifilities promised to the property of the case of the ca

Place: Ahmedabad Sd/- Authorised Officer, PUNJAB NATIONAL BANK

Circle SASTRA Centre, Surat : 1st Floor, Meghani To Station Road, Surat- 395 003. Ph. : 7387087200 E mail : cs8323@pnb.co.in

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES THROUGH E-AUCTION

Date of E-Auction : 08.12.2023 | Date & Time of Inspection : 01.12.2023 (Between 11.00 AM to 4.00 PM)
EMD should be deposit by E-Auction Time

property mortgaged/charged to the Secured Creditor, the constructive/physical/symbolic possession of which has been to the sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 08.12.2023 from 11:00 AM to 04:00 pm with 10

	Name of Branch	SCHEDULE OF THE SECURED ASSETS	A) Dt. Of Demand Notice u/s 13(2) of SARFAESI ACT 2002	A) Reserve Price	Details of t encumbran
lo.	Name of Account Name & address of the	Description of the Immovable	B) Outstanding Amount as on	B) EMD	known to the
	Borrower / Guarantors Account	Properties Mortgaged / Owner's Name (Mortgagers of property(ies)	C) Possession Date u/s 13(4) of SARFAESI ACT 2002	C) Bid Increase	creditors
			D) Nature of Possession Symbolic/Physical/Constructive	Amount (All Amt. in Lacs)	Property ID
l.	PNB : Pardi 794300	All that pieces and parcel of residential Flat No. 6 admeasuring 630	A) 31.03.2021	A) Rs 8.50	Not Known
	Mr. Lunaviya Gargeshkumar Parsottambhai (Borrower), Mrs. Urmila	sq feet i.e 58.55 sq meters super built up area situated on the second floor of the building known as VIPUL SHOPPING COMPLEX	B) Rs. 6,46,455/- + Further interest	B) Rs.0.85	1
	Pratapsinh Parmar (Guarantor & Mortgager)	constructed on NA land bearing Plot No. 1 admeasuring 1544 sq meters bearing city survey no 3358 consisting of old survey no	+ Expenses thereon	C) Rs 0.10	1
	Flat No. 6, Vipul Complex, Near Pardi Char Rasta, Pardi. 396125 Mr. Lunaviya Gargeshkumar	14/1 situated at Pardi within the municipal limits of Pardi Nagarpalika, Tal. Pardi, Dist Valsad owned by Urmillaben Pratapsinh Parmar, East: O.T.S/Road, West: Entry Passage, North: Flat No.7,	C) 10.08.2023		
	Parsottambhai (Borrower), Mrs. Urmila Pratapsinh Parmar	South: Flat No.5	D) Symbolic Possession		PUNB 794300
	(Guarantor & Mortgager)				LGKP06
2.	PNB : CHALA (599000) MR RAGHURAJ RAJVEER SINGH	All The Piece And Parcel Of The Immovable Property Being Residential Flat 402, Admeasuring About 539.70 Sqft I.e. 50.16	A) 15.03.2023	A) Rs 7.29	Not Known
	Add- Flat no. 402, Maruti Residency, 4th Floor, Bulding-B, Wing-X, Nilayam Park,	Sqmt. Built Up Area, lying And Located On The 4th Floor Of X Wing Known As "maruti Residency" Constructed On N.a.land Bearing Survey No. 140/paikee1, Part-2 Adm 2513.83 Sqmt Situated At	B) Rs. 8,80,353.00/- + further interest +Expenses thereon	B) Rs.0.73	
	Poniya Road, Pardi-Dist-Valsad, 396191	Village Pardi,taluka Prdi Dist-valsad , Gujarat State. (owned By	C) 26.06.2023	C) Rs 0.10	PUNB
		Raghuraj Rajveer Singh)	D) Symbolic Possession		5900 RAGHU
3.	PNB : Parab (997400)	The property opinion on investigation on title and obtaining of	A) 17-11-2022	A) Rs 09.00	Not Known
	Mr. Dhanjibhai Chanabhai Khania (Borrower) Block No-159 & 162,	search report in respect of property situated at Plot No .432 admeasuring 46.66 sq yard after KJP Block No 159/432/A	B) Rs.10,17,694.50	B) Rs.0.90	1
	NEW Block-159 Plot No-432"Aradhana Dream.Vibhag-1" B/H Jolva Village	admeasuring 39.05 sq mtrs together with undivided proportionate share in road and COP admeasuring 20.56 sq. mts at "Aradhna	+ further interest +Expenses thereon	C)Rs.0.10	1
	Panchayat, Jolva , Taluka-Palsana Dist-Surat-394305	Dream Vibhag-1* situated at land bearing New Block No 159(Block no.s 159 and 162) of village Jolwa, Sub District-Palsana, District-	C) 10.02.2023		PUNB
	Mr Rameshbhai Chanabhai Khania (Guarantor)Flat No-101, Dwarkadhish Flats	Surat	D) Physical Possession		9974
1.	Part-B, Ved Road, Katargram, Surat-395004 PNB: Punakumbharia (992200)	All that piece and parcel of immovable property situated at Plot	A) 10 11 2010	A) De 00 00	DHAN432
4.	Mr Amitkumar Harishankar Singh &	No.317 in "Rahi Township Vibhag-1" situated on land bearing khata	A) 19-11-2019 B) Rs.08.90,259.06	A) Rs 09.80	Not Known
	Mrs Suman Devi Amit Kr Singh (Borrower) Add: Plot No.317, Rahi	No.1149, Survey No.352, Block No.369, behind Gangadhara Arogya Kendra, Kareli, Taluka -Palsana, Dist. Surat in the name of Mr. Amitkumar Harishankar Sloph & Mr. Suman Amitkumar Sloph	+ further interest + Expenses thereon	B) Rs.0.99	-
	Township Kareli Palsana Surat-395003 Also, at: Plot No.280 Gr. Floor, Sai Nagar	Mr Amitkumar Harishankar Singh & Mr Suman Amitkumar Singh.	C) 23-11-2022	C)Rs.0.10	
	Society, Near Prajapati Bhawan, Dindoli Surat-394210		D) Physical Possession		
	Mrs Kavita Ajaykumar Pandey, Shivam Ajaykumar Pandey &				
	Kishan AjaykumarPandey (Legal Heir of Late. Mr Ajaykumar Ramdhok Pandey,				PUNB
	Guarantor) Add: Plot No. 151, Rahi Township, Nr B K Park, Palsana,				9922
5.	Surat-394315 PNB : VIP ROAD VESU (598600)	All that Right and interest in the property plot no 96 admeasuring	A) 15.10.2022	A) Rs 9.45	AMIT317 Not Known
	Mrs.Sudhakar Chintaman Patil & Mrs.Meena Sudhakar Patil (Borrowers)	50.66sq.yd(as par k j p block no 13/96,admeasuring area 42.38sq.meters),together with undivided proportionate share	B) Rs.8.84.451.86	A) RS 9.45 B) Rs.0.95	- TOUR TOUR
	Add- Plot NO: 96 Block No 13/96 Aaradhna Lake Town Vibhag-4 Jolva	admeasuring 16.16 sq.mt in the common road and cop with all appurtenances pertaining thereto, of the housing society known	+ further interest +Expenses thereon	C)Rs.0.10	1
	Surat-394305	and named as Aaradhna Lake Town, vibhag-4 situated on the land bearing new rev block no 13(old block no 13 and 14)of moje	C) 10.02.2023	J110.U.1U	
	Mr.Ganeshvar Sukhdev Patil(Guarantor) Add: Plot No.66, Aradhana Lack Town	village-jolva taluka palsana district surat(Mr.Sudhakar Chintaman Patil(borrower) and Mrs.Meena Sudhakar Patil (Co-borrower)	D) Symbolic Possession		PUNB 5986
	Vibhag-04, Near Aradhana Palace, Jolwa Panchayat, Palsana Surat-394305	8			SUDH96
5.	PNB : Navsari (156620) Mr. Haresh Ambalal Patel (Borrower).	Property Situated at Antroli Tal. Palsana, Dist. Surat Having R.S. No. 1,2,3,5,7,11,12,13,14,15, Block No:1 paiky 3 paiki plot no.	A) 19.01.2023	A) Rs 6.79	Not Known
	Mrs. Shilpaben Hareshkumar Patel (Co-Borrower), Add- Flat No. A/301,	146,147,148,149,and 150 Flat No A/301,Third Floor SHREE RESIDENCY A-Building Opp Antonio Business Hub Moje Antroli	B) Rs.7,80,519.77/- + further interest	B) Rs.0.68	
	3 st Floor, Shree Residency, A-Wing, Opp. Antonio Business Hub, Antroli.	Taluka Palsana Dist-Surat	+Expenses thereon	C) Rs 0.10	PUNB
	орр. силоно овонюзо пов, АЛООП.		C) 03.08.2023		156620
7.	PNB : DEVKA BEACH (717000)	All the piece and parcel of the immovable Property being	D) Symbolic Possession A) 23.01.2023	A) Rs 6.43	HAP301 Not Known
	Sufiya Sarfraz Shaikh Add- Flat No-408 4 th Floor Wing A	Residential Flat no. 408, adms about 650,00 Sq. Fts., i.e. 60,38 Sq.	B) Rs.11,92,003.50/-	B) Rs.0.65	- NOT KITOWII
	Naz Park Karvad, Vapi-396191 Mrs-Sarfaraj Abdul Rauf Shaikh	Mtr, super built up area, lying and located on 4* floor of A building known as "NAAZ PARK" situated at village Karvad, Tai -Vapi, Dist- Valsad (Property owned by Mrs. Suflya Sarfraz Shaikh)	+ further interest + Expenses thereon	C) Rs 0.10	-
	Adress-House No-104/871, Imran Nagar Gita Nagar Road Vapi-396191	Tables (1 topol ty office by mile. Sunya Sarinaz Shakkiy	C) 17/06/2023	G) NS 0.10	PUNB 717000
	Gita Nagar Hoad Vapi-390191		D) Physical Possession		SSS408
3.	PNB : DEVKA BEACH (717000) Mrs. Munni kalam khan &	All the piece and parcel of the immovable Property being Residential Flat no, 406, adms about 650.00 Sq. Fts., ie. 60.38 Sq.	A) 23.01.2023	A) Rs.5.85	Not Known
	Mr. Kalam Haqdad Khan Adress-43,	Mtr, super built up arca, lying and located on 4" floor of C bilding known as NAAZ PARK situated at village -karvad , Tal-Vapi,Dist-	B) Rs.11,15,589.65/- + further interest	B) Rs.0.60	
	Silvassa Road Kanchan Nagar- Vapi396191	Valsad owned by Mr.Kalam Haqdad khan & Mrs. Munni Kalam Khan.	+Expenses thereon	C) Rs 0.10	PUNB
			C) 17/06/2023		717000
3.	PNB : Vapi GIDC (182120)	All the piece and parcel of the immovable property being residential	D) Symbolic Possession A) 01.11.2021	A) Rs 6.30	MKK406 Not Known
	Md. Jainuddin Mohammadfarid Khan (Borrower), Smt. Saharun Nisha	Flat situated at RS no. 297/Paikee, Plot no 55,56,65 and 66, Flat no. A 402, admeasuring 694.00 sq.ft i.e. 64.47 sq.mt. Naaz	B) Rs.11,23,257.05/-	B) Rs.0.63	
	(Co-Borrower), Add- Flat No. A-402,	Residency, At. Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jainnudin Mohammadfarid Khan	+ further interest + Expenses thereon	C) Rs 0.10	
	Naaz residency, At Karwad, vapi Valsad 396191		C) 17.06.2023	2,	PUNB 182120
_			D) Physical Possession		JMK402
	PNB : Vapi GIDC (182120)	All the piece and parcel of the immovable property being residential	A) 03.06.2021	A) Rs 4.32	Not Known
10.	Mr. Jannat Khan (Borrower)	Flat situated at RS no. 297/Paikee, Plot no 55,56,65 and 66, Flat no.			
10.	Mr. Jannat Khan (Borrower), Sml. Shammo Jannat Khan (Co.Rorrower) Add. Flat No. 4-101	Flat situated at RS no. 297/Paikee, Plot no 55,56,65 and 66, Flat no. A 101, admeasuring 476 sq.ft i.e.44.22 sq.mt Naaz Residency, At.	B) Rs.7,61,630.00/- + further interest	B) Rs.0.43]
10.	Smt. Shammo Jannat Khan (Co-Borrower), Add- Flat No. A-101, Naaz Residency, At Karwad, Vapi Valsad	Flat situated at RS no. 297/Paikee, Plot no 55,56,65 and 66, Flat no.	B) Rs.7,61,630.00/- + further interest + Expenses thereon	B) Rs.0.43 C) Rs 0.10	PUNB
10.	Smt. Shammo Jannat Khan (Co-Borrower), Add- Flat No. A-101,	Flat situated at RS no. 297/Paikee, Plot no 55,56,65 and 66, Flat no. A 101, admeasuring 476 sq.ft i.e.44.22 sq.mt Naaz Residency, At.	B) Rs.7,61,630.00/- + further interest +Expenses thereon C) 17.06.2023	- 10	182120
	Smt. Shammo Jannat Khan (Co-Borrower), Add-Flat No. A-101, Naaz Residency, At Karwad, Vapi Valsad 396191 PNB: Vapi GIDC (182120)	Flat situated at RS no. 297/Pakee, Plot no 55,56,56 and 66, Flat no. A 101, admassuring 476 sq.11t. At 2,93 and 1Naza Residency, At. Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential.	B) Rs.7,61,630.00/- + further interest + Expenses thereon	- 10	
	Smt. Shammo Jannat Khan (Co-Borrower), Add- Flat No. A-101, Naaz Residency, At Karwad, Vapil Valsad 396191 PNB: Vapi GIDC (182120) Mr. Kalam Haqdad Khan (Borrower),	Flat shated at RS no. 297/Pales, Plot no 55,56.5 and 66, Flat no. A 101, damessuring 75 sept. 11e. 42.2 gard no Naze Residency, Al. Karward Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales, Plot no 55,56.5 and 66. Flat no. A009, damessaring 555 sept. 16. 52.57 and Naze Residency, Mr. A009, damessaring 555 sept. 16. 52.57 and Naze Residency, Mr.	B) Rs.7, 61,630.00/- + further interest + Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 01.11.2021 B) Rs.7,81,224.50/-	C) Rs 0.10 A) Rs 5.40	182120 JANK101
	Sml. Shammo Jannat Khan (Co-Bornwerk, Jad-Flat No. A-101, Nazz Residency, At Karwad, Vapi Valsad 396191 PNB: Vapi GIDC (182120) Mr. Kalam Haqdad Khan (Borrower), Sml. Munin kalalm Khan (Co-Borower), Sml. Munin kalalm Khan (Co-Borower),	Flat shatadr dt RS no. 297/Palies, Plot no 55,56,55 and 66, Flat no. A 101, damessaring 75s coll. 14.4.22 sea, Plot no 15,56,55 and 66, Flat no. A 101, damessaring 75s coll. 14.22 sea, Plot no 15,56,55 and 66, Flat no. A 101, dames 2 sea, Plot no 15,56,55 and 66, Flat no. A 101, dames 2 sea, Plot no 15,56,55 and 66, Flat no. Plot no 55,56,55 and 66, Flat no.	B) Rs.7,61,630.00/- + further interest + Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 01.11.2021	C) Rs 0.10	182120 JANK101 Not Known
	Sml. Shammo Jannat Khan (Co-Bornwer), Add-Flat No. A-101, Nazz Residency, At Karwad, Vapi Valsad 396191 PNB: Vapi GIDC (182120) PNR: Wapi GIDC (182120) Sml. Munni kalalm Khan (Co-Bornover), Sml. Munni kalalm Khan (Co-Bornover)	Flat shaated at RS no. 287/Palese, Pixt no 55,56,55 and 66, Flat no. A 101, damessaring 755 ag. II.d. 44.22 as unit Naza Flassidinery, Markard Vagi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. Karwad Vagi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A III. In price and gareat of the immovable property being real-directal Flat processes of the	B) Rs.7,61,630.00/- + further interest + Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 01.11.2021 B) Rs.7,81,224.50/- + further interest	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54	182120 JANK101 Not Known
11.	Smt. Shammo Jannat Khan (Co-Borrower), Affa No. A-101, Naza Residency, Af Karwad, Vapi Valisad 395191 PMB: Vapi GIDC (182120) Mc. Kalam Hapdad Khan (Borrower), Smt. Manni Jalahim Khan (Co-Borrower), Ad-Frat Mo. A-20, Naza residency, Af Karwad, Vapi Valsad 395191	Flat shated at RS no. 287/Palese, Pixt no 55,56,55 and 66, Flat no. A 101, damessaring Pixt sp. 111, 44.72 sam Naza Flassforty, Ark Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and pared of the immovable property belon residential flat shated at RS no. 287/Palese, Pixt no 55,56,55 and 66, Flat no. A 309, admension 95 san (In. 15.27) and Naza Residency, At. Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Manni kalalm Khan	B) Rs.7,61,630.00/- + further interest + Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 01.11.2021 B) Rs.7,81,224.50/- + further interest + Expenses thereon	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10	182120 JANK101 Not Known PUNB 182120 KHK309
11.	Sml. Shammo Jannat Khan (Co-Bornwerk, Jad-Flat No. A-101, Nazz Residency, At Karwad, Vapi Valsad 396191 PNB: Vapi GIDC (182120) Mr. Kalam Haqdad Khan (Borrower), Sml. Munin kalalm Khan (Co-Borower), Sml. Munin kalalm Khan (Co-Borower),	Flat shated at RS no. 287/Pales, Plot no 55,56,58 and 66, Rat no. A 101, damessaring 75 sp. Int. et At 22 and Naza Pasidency. At Card Act of Section 1, 200 and 1, 20	B) Rs 7.61 80.00½- * surface included * Eupenses themon C) 17.05.2023 D) Physical Possession A) 01.11.2021 B) Rs 7.81 224.50½- * further interest * Eupenses themon C) 17.05.2023 D) Physical Possession A) 22.01.2023	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10 A) Rs 5.85	182120 JANK101 Not Known PUNB 182120
11.	Smt. Shammo Jannat Khan (Co-Berrower), Affe Tatto A101, Naza Piesdomy, Af Karwad, Vapa Valsad 306191 Mer. Kaliam Haędad Khan (Borrower), Smt. Mamit Nalaim Khan (Co-Borrower), Smt. Mamit Nalaim Khan (Co-Borrower), Af Karwad, Vapi Valsad 306191 Mr. Shanakarthal Ambulshia Barandiya Affersa-401 (Shasa Rod), Kari franzinya Affersa-401 (Shasa Rod), Kari franzinya	Filst shated at RS no. 287/Pales, Plot no 55,565 and 66, Flat no. A 101, damessaring 75 sp. fl. no. 44.22 and no. Naze Residency, Al- Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A 101, damessaring 75 sp. fl. no. 42 and parcel of the immovable property being residential Filst shated at RS no. 287/Pales, Plot no 55,565 and 66, Flat no. 430,94 amessaring 755 sq. flat. 15,57 sq. mt, Naze Residency, Al. 430,94 amessaring 755 sq. flat. 15,57 sq. mt, Naze Residency, Al. 600 mt 101,040 mt 101,04	B) Rs.7.61.630.00V+ **Lumbin Interest* **Lepinisas Interest* C) 17.06.2023 D) Physical Possession A) 0.1.11.2021 B) Rs.7.61.224.50V **Lumbin Interest* **Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs.1.22.4,597- **Lumbin Interest* **	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10	182120 JANK101 Not Known PUNB 182120 KHK309
11.	Smt. Shamma Jannat Khan (Co-Borrower), Adr Fatto A101, Naza Residency, Al Karwad, Vapi Valisad 306191 PMB: Vapi GIDC (182120) Mc. Kalam Hapdad Khan (Borrower), Smt. Manni Jalahi Khan (Co-Borrower), Al Karwad, Vapi Valsad 396191 PMB: DEVKA BEACH (717000) Mc. Shankarshal Ambubhal Barodiya	Filst shated at RS no. 287/Pales, Plot no 55,56,56 and 66, Flat no. A 101, damesuring 75 sea, 116. 44.22 surf Naze Residency, At Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Filst shated at RS no. 287/Pales, Plot no 55,56,56 and 66, Flat no. A309, damesuring 955 sq. 116. 15,527 sq. mt, Nazz Residency, At Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Munni kaialim Khan. All the piece and parcel of the immovable property being	B) Rs.7.61.830.00/- + further interest + Expenses thereon (5) 17.08.2023 (5) Physical Possession A) 01.11.2021 (5) Rs.7.81.224.50/- + further interest + Expenses thereon (5) 17.08.2023 (7) Physical Possession A) 22.01.2023 (8) Rs.12.29.557/- + further interest + Expenses thereon	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10 A) Rs 5.85	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known
11.	Smt. Shammo Jannat Khan (Co-Berrower), Affe Tatto A101, Naza Piesdomy, Af Karwad, Vapa Valsad 306191 Mer. Kaliam Haędad Khan (Borrower), Smt. Mamit Nalaim Khan (Co-Borrower), Smt. Mamit Nalaim Khan (Co-Borrower), Af Karwad, Vapi Valsad 306191 Mr. Shanakarthal Ambulshia Barandiya Affersa-401 (Shasa Rod), Kari franzinya Affersa-401 (Shasa Rod), Kari franzinya	Filst shated at RS no. 287/Pales, Plot no 55,565 and 66, Flat no. A 101, damessaring 75 sp. fl. no. 44.22 and no. Naze Residency, Al- Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A 101, damessaring 75 sp. fl. no. 42 and parcel of the immovable property being residential Filst shated at RS no. 287/Pales, Plot no 55,565 and 66, Flat no. 430,94 amessaring 755 sq. flat. 15,57 sq. mt, Naze Residency, Al. 430,94 amessaring 755 sq. flat. 15,57 sq. mt, Naze Residency, Al. 600 mt 101,040 mt 101,04	B) Rs.7.61.630.00/+ further interest + Expenses thereon C) 17.05.2023 D) Physical Possession A) 0.111.2021 B) Rs.7.81.224.50/- + further interest + Expenses thereon C) 17.05.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs.12.23.957/- + further interest + Expenses thereon C) 17.05.2023	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs.0.60	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000
11.	Smt. Shamma Jannat Khan (Co-Borrower), Adr Fatto A101, Naza Residency, Al Karwad, Vapi Valisad 306191 PMB: Vapi GIDC (182120) Mc. Kalam Hapdad Khan (Borrower), Smt. Manni Jalahi Khan (Co-Borrower), Al Karwad, Vapi Vaisad 396191 PMB: DEVIKA BEACH (717000) Mc. Shankarshal Ambubhal Barodiya Adress-401 Sivassa Road, Near Imran Napar masjid, kanchan Napar Vapi-396191	Flat shated at RS no. 287/Pales, Plot no 55,565 and 66, Flat no. A 101 damesuring 75 sea. Incl. 44.22 and Naze Residency, Naze Residency, Naze Rsidency, At. 4309, damesuring 95 seg. Int. 16, 52.75 sq. mt, Naze Rsidency, At. Karwak Qsp. Values Rsidency, At. Karwak Qsp. Values Rsidency, At. Karwak Qsp. Values Rsidency, At. Carwak Values Rsid	B) Rs 7.6 180.00½- + butther inchroot + butther inchroot + butther inchroot + Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 01.11.2021 B) Rs 7.8 1.224.50½- + further interest + Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs 12.23.9577- + further interest + Expenses thereon C) 17.06.2023 D) Symbolic Possession	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405
11.	Smt. Shamma Jannat Khan (Co-Borrower), Adr Fatto A101, Naza Residency, Al Karwad, Vapi Valisad 306191 PMB: Vapi GIDC (182120) Mc. Kalam Haqdad Khan (Borrower), Smt. Manni Jalahi Mkan (Co-Borrower), Al Karwad, Vapi Valsad 306191 PMB: DEVIKA BEACH (717000) Mc. Shankarshai Ambubhai Barodiya Adress-401 Siwassa Road, Mear Imran Napar masjid, kanchan Napar Vapi-396191 PMB: Vapi GIDC (182120) Mrs. Tabassam Khaboo (Borrower),	Filst shaated at RS no. 287/Palese, Plot no 55,56,56 and 66, Flat no. A 101, damessaring 75 spc. Int. 44.22 and no. Naza Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable properly being residential resident	B) Rs 7.61 80.00½- to the third control of third c	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000
11.	Smt. Shamma Jannat Khan (Co-Borrower), Aff-Takt On. 4101, Naza Piesdomy, Af Karwad, Vapa Valisad 396191 PMB: Vapi GIDC (182120) Mc. Kaina Negde (Than (Borrower), Add-Tak No. A-309, Nazz residency, Af-Karwad, Vapi Valisad 396191 PMB: DEVKA BEACH (717000) Mc. Shankarshal Ambubhal Baradiya Affersa-401 (Shasan Soud, Kear Irana Nagar masjd, kanchan Nagar masjd, kanchan Nagar masjd, kanchan Nagar masjd, kanchan Nagar Masil Ambubhal Baradiya Mrss. Tabassam Kallon (Berower), Mc. Shirak Kallon (Berower),	Filst shated at RS no. 287/Pales, Plot no 55,56,58 and 66, Flat no. A 101 damessaring 75 as flat. 44.22 as Jin Naza Residency, Al- Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Fall shated at RS no. 287/Pales, Plot no 55,56,56 and 66, Flat no. AND damessaring 556 by R11 no. 52.75 as mr., Naza Residency, Al. Karwad Vapi-Valsad 36191. Owned by Mr. Maran Kadalim Khan All the piece and parcel of the immovable Property being residential Fall shated All RS no. 287/Pales, Plot no 55,66,66 and 60, Flat no. All the piece and parcel of the immovable Property being residential Fall shated All RS no. 487/RS no. 48	B) Rs 7.6 8.0.00/- + Expensios themon C) 17.06.2023 D) Physical Possession A) 0.11.1.2021 B) Rs 7.8 1.22.50/- + further interest + Expensios themon C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs 12.24.50/- + further interest + Expenses themon C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs 12.24.957/- + further interest + Expenses themon C) 17.06.2023 D) Symbolic Possession A) 19.11.2018	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs.0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs.0.52	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known
11.	Smt. Shamma Jannat Khan (Co-Berrower), Adr Fitto A101, Islaz Residency, Al Karwad, Vapi Valsad 30f191 PRIB : Vapi GIDC (182120) Mr. Kaliam Haqdad Khan (Borrower), Smt. Munit Islaim Khan (Co-Borrower), Adr Christ (MA.) Shar Endelleny, Al Karwad, Vapi Valsad 306191 PRIB : DEVKA BEACH (777009) Mr. Shamkarshal Ambushal Barodry Androwad, Vapi Valsad Shan (Barodry Androwad, Vapi Valsad Shan Nagar Vapi-396191 PRIB : Vapi GIDC (182120) Mr. Tabassum Khatoon (Barower), Mrs. Shirak Kan (Co-Borrower), Mrs. Shirak Kan (Co-Bo	Filst shaated at RS no. 287/Palese, Plot no 55,56,56 and 66, Flat no. A 101, damessaring 75 spc. Int. 44.22 and no. Naza Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable properly being residential resident	B) Rs.7.61.830.00V+ ** further interest* *- Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 0.1.11.2021 B) Rs.7.81.224.501 B) Rs.7.81.224.502 Expenses thereon C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs.12.20.507 ** further interest* *- Expenses thereon C) 17.06.2023 D) Symbolic Possession A) 18.11.2018 B) Rs.9.66.070.0004 *- further interest* *- Expenses thereon A) 18.11.2018 B) Rs.9.66.070.0004 *- further interest* *- Furt	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known
11.	Smt. Shamma Jannat Khan (Co-Borrower), Aff-Takt On. 4101, Naza Piesdomy, Af Karwad, Vapa Valisad 396191 PMB: Vapi GIDC (182120) Mc. Kaina Negde (Than (Borrower), Add-Tak No. A-309, Nazz residency, Af-Karwad, Vapi Valisad 396191 PMB: DEVKA BEACH (717000) Mc. Shankarshal Ambubhal Baradiya Affersa-401 (Shasan Soud, Kear Irana Nagar masjd, kanchan Nagar masjd, kanchan Nagar masjd, kanchan Nagar masjd, kanchan Nagar Masil Ambubhal Baradiya Mrss. Tabassam Kallon (Berower), Mc. Shirak Kallon (Berower),	Filst shated at RS no. 287/Pales, Plot no 55,56,58 and 66, Flat no. A 101 damessaring 75 as flat. 44.22 as Jin Naza Residency, Al- Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Fall shated at RS no. 287/Pales, Plot no 55,56,56 and 66, Flat no. AND damessaring 556 by R11 no. 52.75 as mr., Naza Residency, Al. Karwad Vapi-Valsad 36191. Owned by Mr. Maran Kadalim Khan All the piece and parcel of the immovable Property being residential Fall shated All RS no. 287/Pales, Plot no 55,66,66 and 60, Flat no. All the piece and parcel of the immovable Property being residential Fall shated All RS no. 487/RS no. 48	B) Rs.7.61.830.00/+ **Iurther Interest* **C+Expenses thereon C) 17.08.2023 D) Physical Possession A) 0.11.1.2021 B) Rs.7.81.224.50/+ **Iurther Interest* **C+Expenses thereon C) 17.08.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs.12.29.57/- **Iurther Interest* **C+Expenses thereon C) 17.08.2023 D) Symbolic Possession A) 19.11.2018 B) Rs.9.66.070.00/+ **Iurther Interest* **Legenses thereon C) 4.10.8021 B) Rs.9.66.070.00/- **Iurther Interest* **Legenses thereon	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs.0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs.0.52	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known
11.	Smt. Shamma Jannat Khan (Co-Berrower), Adr Fish (A101), Naza Residency, Al Karwad, Vapal Valsad Soffish PNB: Vapil GIDC (182120) Mc. Kaliam Hagdad Khan (Borrower), Smt. Munit Islaim Khan (Co-Berrower), Adr Charl (M. A50), Naza residency, Al Karwad, Vapil Valsad PNB: DEVKA BEACH (7.17000) Mc. Shamkarchia Ambubbal Barodity And Charwad, Vapil Valsad PNB: Vapil GIDC (182120) Mrs. Tabasam Khabadon (Barower), Mrs. Shassam Khabadon (Barower), Mrs. Shassam Khabadon (Barower), Mrs. Tabasam Khabadon (Barower), Mrs. Tabasam Khabadon (Barower), Add-Fish (M. Ar) Add-Fish (M. Ar) PNB: Udelin Surat (453500)	Filst shaated att RS no. 287/Palese, Plot no 55,56,56 and 66, Flat no. A 101, damessaring 75 sept. 11d. 44.22 and no Naza Residency, Naza Resi	B) Rs 7.6 180.00½- to the third control of third contr	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs.0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs.0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs.0.52	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known PUNB 182120
11.	Smt. Shamma Jannat Khan (Co-Berrower), Ade Fish (A101), Islaz Residency, Al Karwad, Vapit Valsad Soffeti PRIB: Vapit GIDC (182120) Mr. Kalam Hapdad Khan (Borrower), Smt. Mami Islain Khan (Co-Borrower), Ade That (MA. 20), Alaz residency, Al Karwad, Vapit Valsad 386191 PRIB: DEVKA BEACH (717000) Mr. Shamharshal Ambubhal Barediya Afrisas-461 (Swassa Road, Mea firman Nagar masjd, Kanchen Nagar Vapi-386191 PRIB: Vapit GIDC (182120) Mrs. Tabassum Chalone (Borrower), Mrs. Sharik Man (Co-Borrower), Ade-Fish Vo. A. 707, Nazz Residency, At Karwad, Vapit Valsad PRIB: Uddnin Surrat (455500) Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. A. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. 503 Mr. Dalpatriaph Khumanshiph Raiput (Borrower), Ade-Fish Vo. 503 Mr. D	Filst shated at RS no. 287/Pales (Plan no. 55,65 and 66, Ratno. A. 101 damesuring Priso gail. 16.4 x2 gard Naza Residency, At Carwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Filst shated at RS no. 297/Pales (Plan no. 55,65 and 66, Ratno. A. 309, damesuring 955 sq. 11.6. 55.27 sq. mt. Naza Residency, At. Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Marin kalalim Khan. All the piece and parcel of the immovable Property being residential Falmo. 405, adms about 550,000 Sq. 18s. 1.6. 60.38 Sq. Milks. super ball up and plan afford of building known as "MoV2, PriNew" shated at village "Asynatch layur, distributed of the piece and parcel of the immovable property being residential Falmo. 405, adms about 550,000 Sq. 18s. 1.6. 60.38 Sq. Milks. super ball up and located or 4 floor of D building known as "MoV2, PriNew" shated at village "Asynatch layur, distributed at NS no. 297/Pales Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales (Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales (Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales (Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential fath and parcel	B) Rs.7.61.830.00V+ huthbri interest + Euphines hierori C) 17.06.2023 D) Physical Possession A) 01.11.2021 B) Rs.7.81.224.50V- huthbri interest + Euphines hierori C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs.12.24.55V- + Euphines hierori C) 17.06.2023 D) Physical Possession A) 22.01.2023 B) Rs.12.24.957V- + further interest + Euphines hierori C) 17.06.2023 D) Symbolie Possession A) 18.11.2018 B) Rs.9.66.070.00V- + huthbri interest + Euphiness hierori C) 13.07.2023 D) Physical Possession A) 03.06.2023 B) Rs.7.80.41.00V- + huthbri interest + Euphiness hierori A) 03.06.2023 B) Rs.7.80.41.00V- + huthbri interest + Euphinession A) 03.06.2023	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs 0.52 C) Rs 0.10	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known PUNB 182120 TAB107
11.	Smt. Shamma Jannat Khan (Co-Berrower), Ade Fish (A. +01), Naza Residency, Al Karwad, Vapal Valsad Sof191 PMB: Vapil GIDC (182120) Mc. Kalam Hapdad Khan (Borrower), Smt. Muni Isalain Khan (Co-Berrower), Ade Hall (A80), Naza residency, Al Karwad, Vapil Valsad 380191 PMB: DEVKA BEACH (177000) Mc. Shamisarshal Ambushal Barodiya Adress-4-031 (Swassa Road, Near Imma Nagar mangid, karchen Nagar Vapi-386191 PMB: Vapil GIDC (182120) Mrs. Tabassam Khalaon (Borrower), Ade-Fish No. A-107, Naza Residency, Al Karwad, Vapi Valsad Mc. Displastingh Kumansingh Ralpst (Borrower), Ade-Fish O. A. (20), Naza Residency, Al Karwad, Vapi Valsad Mc. Displastingh Kumansingh Ralpst (Borrower), Ade-Fish O. A. (20), Naza Rosidency, Nagar Society - 1, Nr. Archans School, Nagar Society - 1, Nr. Archans School, Nagar Rosidency, Loyera (Rosidency)	Filst shated at RS no. 287/Pales (Plan no. 55,65 and 66, Ratno. A. 101 damesuring Priso gail. 16.4 x2 gard Naza Residency, At Carwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Filst shated at RS no. 297/Pales (Plan no. 55,65 and 66, Ratno. A. 309, damesuring 955 sq. 11.6. 55.27 sq. mt. Naza Residency, At. Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Marin kalalim Khan. All the piece and parcel of the immovable Property being residential Falmo. 405, adms about 550,000 Sq. 18s. 1.6. 60.38 Sq. Milks. super ball up and plan afford of building known as "MoV2, PriNew" shated at village "Asynatch layur, distributed of the piece and parcel of the immovable property being residential Falmo. 405, adms about 550,000 Sq. 18s. 1.6. 60.38 Sq. Milks. super ball up and located or 4 floor of D building known as "MoV2, PriNew" shated at village "Asynatch layur, distributed at NS no. 297/Pales Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales (Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales (Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales (Potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential Flat shated at RS no. 297/Pales potton 55,566 fath no. A 107, administration of the piece and parcel of the immovable property being residential fath and parcel	B) Rs 7.6 (80.00½- b) The 17.6 (80.00½- b) The 17.6 (80.00½- b) Physical Possession A) 01.11.2021 B) Rs 7.8 (12.24.50½- b) Physical Possession A) 22.1 (20.23 D) Physical Possession A) 22.0 (20.23 D) Physical Possession A) 22.0 (20.23 D) Physical Possession A) 22.0 (20.23 D) Symbolic Possession A) 13.1 (20.25 D) Symbolic Possession A) 13.1 (20.25 D) Symbolic Possession C) 13.07 (20.23 D) Symbolic Possession C) 13.07 (20.23 D) Physical Possession C) 13.07 (20.23 D) Physical Possession C) 13.07 (20.23 D) Physical Possession C) 18.07 (20.23 D) Physical Possessio	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs 0.52 C) Rs 0.10 A) Rs 7.80	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known PUNB 182120 TAB107
11.	Sant, Shammo Jannat Khan (Co-Berrower), Aff-Tatto A101, (De-Berrower), Aff-Tatto A101, (Naza Residency, At Karwad, Vapa Valsad 396191 PHB: Vapal GIDC (182120) Mc. Kaina Negdet (han; (Bernower), Add-Tata No. A-309, Naza residency, Add-Tata No. A-309, Naza residency, At Karwad, Vapi Valsad 396191 PHB: DEVKA BEACH (717000) Mc. Shankarshal Ambubhal Baradiya Adress-401; Nisasa Road, Kear Irana Nagar masjd, kanchan Nagar Vapi-396191 PHB: Vapal GIDC (182120) Mc. Shankarshal Ambubhal Baradiya Adress-401; Nisasa Road, Kear Irana Nagar masjd, kanchan Nagar Vapi-396191 PHB: Vapal GIDC (182120) Mc. Shankarshal Ambubhal Baradiya Add-Tat No. A-10; Naza Pesidency, At Karwad, Vapi Valsad PHB: Udhina Surat (453500) Mc. Dalpatsiniph Khumansiniph Rajput (Borrower), Add-Pit No. A-10; Satzam Nagar Society - It, Archans Schood, Mg. Solyan Starkan School, Mg. Archans School, Mg. Manga Society - It, Archans School, Pit of J. Mahadar Vasidency - I	Filst shaated at RiS no. 287/Palese, Pict no 55,56,56 and 66, Rat no. A. 101, damessaring 745 as ILI. d. 442 zeal no Naza Residency, A. Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. All the piece and parcel of the immovable property being residential Filst shaated at RiS no. 287/Palese, Pict no 55,56,55 and 66, Rat no. Karwad Vapi-Valsad 308191. So 27/Palese, Pict no 55,56,55 and 66, Rat no. Karwad Vapi-Valsad 308191. So 27/Palese, Pict no 55,66,55 and 66, Rat no. Karwad Vapi-Valsad 308191. So 27/Palese, Pict no 55,66,55 and 66, Rat no. Walking Vapi-Valsad 308191. So 27/Palese, Pict no 55,66,57 and 76, Walking Vapi-Valsad 308191. So 27/Palese, Pict no 55,66,57 and 76, Valsad 40,47 and 76, Valsad 40,47 and 76, Valsad 40,47 and 76, Valsad 40,47 and 76, Valsad 41,47	B) Rs 7.8 63 00.00- + sharther independent +	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs 0.52 C) Rs 0.10 A) Rs 7.80 B) Rs 7.80 B) Rs 0.78	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known PUNB 182120 TAB107
12.	Smt. Shammo Jannat Khan (Co-Berrower), Aff- Takt On. 4101, Naza Piesdomy, Af Karwad, Vapa Valisad 306161 PMB. Vapi GIDC (182120) Ne. Kalam Hagdad Khan (Borrower), Nelson Hagdad Khan (Borrower), Add- Rial No. A-309, Naza residency, Af Karwad, Vapi Valsad 306191 PMB: DEVKA BEACH (717000) Mc. Shankarshal Ambubhal Baradiya Adress-401 (Nasas Road, Karalman Nagar masjid, kanchun Nagar Vapi-396191 Mrs. Tabasasam Rhathons (Borrower), Mrs. Tabasasam Rhathons (Borrower), Mrs. Tabasasam Rhathons (Borrower), Af Karwad, Vapi Valsad PMB: Upilna Surat (455500) Mc. Dalpatistiph (Numansiniph Rajput (Borrower) Add- Pitt no. A93, Silzam Nagar Society - I. Nr. Archans School, Panagam Road, Surat (455500) Mc. Dalpatistiph (Numansiniph Rajput (Borrower) Add- Pitt no. A93, Silzam Nagar Society - I. Nr. Archans School, Panagam Road, Surat (495500) Mc. Dalpatistiph (Numansiniph Rajput (Borrower) Add- Pitt no. A93, Silzam Nagar Society - I. Nr. Archans School, Panagam Road, Surat (495500) Mc. Dalpatistiph (Numansiniph Rajput (Borrower) Add- Pitt no. A93, Silzam Nagar Society - I. Nr. Archans School, Panagam Road, Surat (495500) Mc. Dalpatistiph (Numansiniph Rajput (Borrower) Add- Pitt no. A93, Silzam (Bayar Society - I. Nr. Archans School, Panagam Road, Surat (495500) Mc. Ray (1964)	Filst shaated at RS no. 227/Pales, Plot no 55,56,56 and 66, Flat no. A 101, damessaring 75 sp. 11.6. 44.22 and no Naze Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A 11 miles and parcel of the immovable property being residential residency. Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A 309, admension 95 sp. 11, 11, 15, 27 sp. mt, Naza Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Manni kalalm Khan. All the piece and parcel of the immovable property being residential Risk no. 420/Pales Naze Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Manni kalalm Khan. All the piece and parcel of the immovable Property being Residential Risk no. 405, adms about 650,00 Sq. Rs. I.e. 60.38 Sq. Mr. super bull up area, Jying and located on 4" floor of 10 building known as "NAZ-Play". Statel of village 3-avad Lai vg. disk-valsad (property evened by Mrs. Shankarishad Amabchal barrodys). All the piece and parcel of the immovable property being residential Risk no. 227/Pales, Pot no. 55, 56, 66 Enn. A 107, admessaring 74.00 sq. till. Sq. 232 sq. mt. Sq. Naze Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Tabassum Mohammad Aaral Khan. All that piece and parcel of immovable property bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.27 dept. mt. on the large beauty and the side of the Mohammad Aaral Khan. All that piece and parcel of immovable property bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.27 dept. mt. on the large beauty and the Mohammad Aaral Khan. All that piece and parcel of immovable property bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.27 dept. mt. bear 1864. Residency 1 stated on the large bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.28	B) Rs 7.6 (80.00½- b) The 17.6 (80.00½- b) The 17.6 (80.00½- b) Physical Possession A) 01.11.2021 B) Rs 7.8 (12.24.50½- b) Physical Possession A) 22.1 (20.23 D) Physical Possession A) 22.0 (20.23 D) Physical Possession A) 22.0 (20.23 D) Physical Possession A) 22.0 (20.23 D) Symbolic Possession A) 13.1 (20.25 D) Symbolic Possession A) 13.1 (20.25 D) Symbolic Possession C) 13.07 (20.23 D) Symbolic Possession C) 13.07 (20.23 D) Physical Possession C) 13.07 (20.23 D) Physical Possession C) 13.07 (20.23 D) Physical Possession C) 18.07 (20.23 D) Physical Possessio	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs 0.52 C) Rs 0.10 A) Rs 7.80 B) Rs 7.80 B) Rs 0.78	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known PUNB 182120 TAB107
11.	Smt. Shammo Jannat Khan (Co-Berrower), Adr Fatto A101, Islaz Residency, Al Karwad, Vapal Valsad 396191 396191 Wei Vapil GIDC (182120) Mr. Kaliam Hepdad Khan (Borrower), Smt. Manin Islaim Man (Co-Berrower), Adr Garwad, Vapal Valsad 396191 Mr. Shamma Islaim Man (Co-Berrower), Al Karwad, Vapil Valsad Mr. Shamshami Alambahi Barndiya Adria-Mr. Vapil Valsad Mr. Shamshami Ambahi Barndiya Adria-Mr. Vapil Valsad Mr. Shamshami Ambahi Barndiya Adria-Mr. Vapil Valsad Mr. Shamshami Ambahi Mr. Shamshami Mr. Shamsham (Co-Berrower), Mr. Shamshami Mr. Shams	Filst shaated at RS no. 227/Pales, Plot no 55,56,56 and 66, Flat no. A 101, damessaring 75 sp. 11.6. 44.22 and no Naze Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A 11 miles and parcel of the immovable property being residential residency. Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Jannat Sona Khan. A 309, admension 95 sp. 11, 11, 15, 27 sp. mt, Naza Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Manni kalalm Khan. All the piece and parcel of the immovable property being residential Risk no. 420/Pales Naze Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Manni kalalm Khan. All the piece and parcel of the immovable Property being Residential Risk no. 405, adms about 650,00 Sq. Rs. I.e. 60.38 Sq. Mr. super bull up area, Jying and located on 4" floor of 10 building known as "NAZ-Play". Statel of village 3-avad Lai vg. disk-valsad (property evened by Mrs. Shankarishad Amabchal barrodys). All the piece and parcel of the immovable property being residential Risk no. 227/Pales, Pot no. 55, 56, 66 Enn. A 107, admessaring 74.00 sq. till. Sq. 232 sq. mt. Sq. Naze Residency, Al-Karwad Vapi-Valsad 396191. Owned by Mr. Tabassum Mohammad Aaral Khan. All that piece and parcel of immovable property bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.27 dept. mt. on the large beauty and the side of the Mohammad Aaral Khan. All that piece and parcel of immovable property bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.27 dept. mt. on the large beauty and the Mohammad Aaral Khan. All that piece and parcel of immovable property bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.27 dept. mt. bear 1864. Residency 1 stated on the large bearing Plet no. 441, admissaring 40.28 sq.mt. toppther with admessaring 740.28	B) Rs 7.8 63 00.00- + sharther independent +	C) Rs 0.10 A) Rs 5.40 B) Rs 0.54 C) Rs 0.10 A) Rs 5.85 B) Rs 0.60 C) Rs 0.10 A) Rs 5.22 B) Rs 0.52 C) Rs 0.10 A) Rs 7.80 B) Rs 7.80 B) Rs 0.78	182120 JANK101 Not Known PUNB 182120 KHK309 Not Known PUNB 717000 SAB405 Not Known PUNB 182120 TAB107

Chief Manager, Authorised Officer, Punjab National Bank, Secured Cr

e.gov.in/epublish/app. STATUTORY SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002

Date : 04.11.2023 | Place : Surat

રોજ રૂા.૫–૬ કરોડનું દાન આપી શિવ નાડર સતત મોખરે

ભારતીય ધનપતિઓ વધુ ઉદાર: રૂા.૮૫૦૦ કરોડનું 'દાન' કર્યુ

હોવાના સંકેત મળ્યા છે. ચેરીટી-બિગેઈન ફ્રોમ હોમ'નાં કહેવતને તેઓ હવે સારી સંપતિમાંથી ૫૯% વધુ રકમ એટલે કે કુલ રૂા.૮૪૪૫ કરોડનું 'દાન' કર્યુ જે છેક્ષા ત્રણ વર્ષની સરખામણીમાં ૨૦૦%

એચસીએલના શિવ નાડર પ્રથમ ક્રમે _છે. નિખીલ કાયતે તો તેમની અર્ધી

તેમના પશ્ચીમી 'બિલીયોનર્સ-કલબ'ના ૨૦૨૩માં શિવ નાડરે કુલ રૂા.૨૦૪૨ સાથીદારોમાંથી પ્રેરણા લઈ રહ્યા છે અને કરોડનું દાન કર્યુ એટલે કે તેમાં રોજ તેઓ હવે વધુ 'ઉદાર' પણ બન્યા સરેરાશ રૂા.પ.૬ કરોડનું દાન કરી રહ્યા છે તે બાદ વિપ્રોના કો–ફાઉન્ડર અજીમ પ્રેમજી આવે છે જેણે કુલ રૂા.૧૭૭૪ રીતે લાગુ કરી રહ્યા છે. ૨૦૨૩ના વર્ષમાં કરોડનું દાન કર્યુ અને રસપ્રદ બાબત છે દેશના ૧૧૯ અબજોપતિઓએ તેમની 🗦 આ દાતાઓની યાદીમાં નવી પેઢીના સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રિનિયોર્સ પણ જોડાઈ રહ્યા છે. જેમાં ઝરોવા (સ્ટોક ઈનવેસ્ટમેન્ટ કર્મ)ના નિતિન અને નિખીલ કાયત પણ છે. આ બંધુઓએ જો કે દાન બાબતમાં ૨૦૨૭માં રૂા.૧૧૦ કરોડનું દાન કર્યુ

(2)	ભ	ારતના ટોપ	१० हानवीर
3	۹)	શિવ નાડર	રૂા.૨૦૪૨ કરોડ
50	ર)	અઝીમ પ્રેમજી	રૂા.૧૭૭૪ કરોડ
16	3)	મુકેશ અંબાણી	રૂા.૩૭૬ કરોડ
0	٧)	કુમાર મંગલમ બિરલા	રૂા.૨૮૭ કરોડ
	૫)	ગૌતમ અદાણી	રૂા.૨૮૫ કરોડ
*	٤)	બજાજ ફેમીલી	રૂા.૨૬૪ કરોડ
20	૭)	અનિલ અગ્રવાલ	રૂા.૨૪૧ કરોડ
N.	(٤	નંદન નિલકેર્ણી	રૂા.૧૮૯ કરોડ
0	(٤)	સાયરસ પુનાવાલા	રૂા.૧૭૯ કરોડ
3	90)	રોહિણી નિલકેર્ણી	રૂા.૧૭૦ કરોડ

ગત વર્ષની સરખામણીમાં ૫૯% વધુ પ્રથમ ક્રમે એચસીએલના શિવ નાડર, ટોપ ૧૦ની ચાદીમાં ઈન્ફોસીસના સહસ્થાપક નંદન અને રોહિણી નિલકર્ણીના નામઃ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી પણ 'સખાવત' કરે છે

સંપતિ દાન કરવા માટેના ગિવિગ પ્લેજમાં તેઓ સૌથી નાની ઉમરના દાતા બની

દેશો જો ઉંચા ફગાવાનો સામનો કરી


રહ્યા છે તે ઉપરાંત જયોપોલીટીકલ

અનિશ્ચિતતાઓ પણ વધી છે તેના

કારણે હવે મધ્યસ્થ બેન્કો પણ તેના

રૂા.૨૮૫ કરોડનું દાન કર્યુ જે ગાંધી તિવારીએ પણ રૂા.૨૭ કરોડનું અગાઉના વર્ષની સરખામણીમાં દાન કર્યુ છે. છેજ્ઞા પાંચ વર્ષમાં ૫૦% વધુ હતું તો તેમનાથી પણ વધુ રૂા.૧૦૦ કરોડ કે તેથી વધુ દાન ધનવાન અને દેશના પ્રથમ ક્રમનાં આપનારની સંખ્યા બે માંથી વધુને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ૧૪ની થઈ છે તો રૂા.પ૦ કરોડ થી રૂા.૩૭૬ કરોડનું દાન કર્યુ જે ૮% વધુ રૂા.૧૦૦ કરોડ સુધી આપનારની છે. ભારતની સાત મહિલાંઓ પણ આં સંખ્યા પણ પાંચમાંથી વધીને ૨૪ની યાદીમાં છે. જેમાં પ્રથમ ક્રમે ઈન્ફોસીસના થઈ છે. આ તમામ દાન ફેમીલી ટ્રસ્ટ સહસ્થાપક નંદન નિલકર્ણીના ધર્મપત્ની મારફત અપાયા છે અને તેમાં રોહિણી નિલકર્ણી છે જેણે રૂા.૧૭૦ આદિત્ય બિરલા ગૂપના કુમાર કરોડનું દાન કર્યુ છે. તો થર્મકસના અનુ મંગલમ બિરલા ફેમીલીના રૂા.૨૮૭ પણ હસ્તાક્ષર કર્યા છે અને આ રીતે ગયા છે. જેમાં રાજકીય રીતે સૌથી વધુ આગા– એન્ડ ફેમીલી છે જેણે રૂા.૨૩ કરોડની રકમ દાનમાં અપાઇ છે.

ચર્ચામાં છે. તે ગૌતમ અદાણી એ કરોડનું દાન કર્યુ છે તો યુએસવીના લીના



પાંચ રાજ્યોમાં ચૂંટણી ટાણે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં જબ્બર વધારો નોંધાતા ચૂંટણી પ્રચારના મુદ્દો બન્યો છે. આ વરસે પ્રતિકુળ હવામાનના કારણે ડુંગળીના પાક પર અસર થતા ઉત્પાદન ઘટતા અને માંગ વધતા ભાવ વધ્યા છે ત્યારે ઉત્તર પશ્ચિમ ભારતના શહેર કોલકત્તા જથ્થા બંધ માર્કેટના એક ગોડાઉનમાં આવેલા ડુંગળીના જથ્થામાંથી વર્કસ ડુંગળી સોર્ટઆઉટ કરી રહૃાા છે.

વારાણસીમાં આંતરરાષ્ટ્રીય યુનિફોર્મ-ગારમેન્ટ પ્રદર્શન

વર્લ્ડ યુનિફોર્મ બજાર ૨૦૩૦માં ૨૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા

વારાણસી, તા.૩ આવ્યા છે. ૨૦૨૦માં વર્લ્ડ સમાવેશ રહેશે. દેશમાં યુનિફોર્મ ઉદ્યોગમાં યુનિફોર્મ બજાર ૬.૨ અબજ મોટી વૃદ્ધિ થાય અને મહારાષ્ટ્રમાં ડોલર હતી, જે ૨૦૨૧માં ૮.૪ સોલાપુર તેનું કેન્દ્ર બને તેવાં વડા અબજ ડોલરે પહોંચી અને પ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાંને ૨૦૩૦માં તે ૨૫ અબજ ડોલરે

સાકાર કરવા માટે ૬-૧૮ ડિસેમ્બરે સાલાપુર વારાણસીના શ્રી કાશી ગારમે ન્ટ વારાણસી દિનદયાલ મેન્યુફેક્ચર્સ એસો સિયેશન હેન્ડિકાફ્ટ કોમ્પ્લેક્સમાં ટેક્સટાઈલ (એસજીએમએ) પ્રદર્શન યોજાશે દ્વારા તેનું વાર્ષિક

સંભાવના ધરાવતા વારાણસીમાં વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશના લઈ જવાનું નક્કી કરવામાં વારાણસીમાં પહેલી જવાર આ આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રદર્શન ૧૦,૦૦૦થી વધુ યુનિફોર્મની યોજાઈ રહ્યું ડિઝાઈન અને ૨૦,૦૦૦થી વધુ છે, જેમાં યુનિફોર્મ ફેબ્રિક્સની ડિઝાઈન ૨૦૦થી વધુ

આકર્ષાય એવું લક્ષ્ય છે. એસજીએમએ દ્વારા આ ૭મું આ વવા ની યુનિફોર્મ પ્રદર્શન છે, જે ૧૬- ધારણા છે. ૧૮ ડિસેમ્બરે વારાણસીના શ્રી અા મા કાશી વારાણસી દિનદયાલ મફતલાલ, હેન્ડિકાફ્ટકોમ્પ્લેક્સમાં યોજાશે. વાલજી, એસજીએમએના સતીશ પવારને કચુ મે કસ, પ્રદર્શનના અધ્યક્ષ અને પ્રકાશ સંગમ પવારને સચિવ તરીકે નીમવામાં ૨૫ ર્શાના

iPhone-17નું ઉત્પાદન ચીનમાં નહીં પણ ભારતમાં થશે

સાથે ૨૦૦ અગ્રણી બ્રાન્ડ્સ બ્રાન્ડ્સ એક

છત હેઠળ

આઈફોનના ઉત્પાદનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર Apple હવે ભારતમાં iPhone-૧૭નું ઉત્પાદન કરશે. આ પહેલીવાર હશે જ્યારે Appleની મેન્યુફેક્ચરિંગ કંપની નવા iPhoneનું ઉત્પાદન ચીનની બહાર અન્ય કોઈ

એપલ-સંબંધિત વિશ્લેષક મિંગ ચી કાઉએ દાવો કર્યો છે કે ભારતમાં આઈફોનનું ઉત્પાદન પણ વધશે અને અહીં ઉત્પાદનનો હિસ્સો ૨૦ થી ૨૫ ટકા હોઈ શકે છે. iPhone ૧૭નું પ્રોડક્શન વર્ક ૨૦૨૪ના બીજા ભાગમાં શરૂ થઈ શકે છે. મિંગે પોતાના બ્લોગમાં જણાવ્યું કે કંપની ૨૦૨૫માં લોન્ચ થનારા iPhone ૧૭નું ઉત્પાદન ૨૦૨૪માં જ શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનને ૨૦૨૫માં દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવશે.

ટાટાએ વિસ્ટ્રોન કર્યું હતું એક્વિઝિશનઃ તમને જણાવી દઈએ કે એપલ આઈફોન ભારતમાં એસેમ્બલ થાય છે, એટલે કે આઈફોન તમામ પાર્ટ્સ એસેમ્બલ કરીને બનાવવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર હશે જ્યારે આઈફોન-૧૭ મોડલ ચીનની બહાર ભારતમાં બનાવવામાં આવશે.

કર્ણાટકમાં મચ્છરોમાં ઘાતક ઝીકા વાયરસ મળી આવતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

ચિકકબક્ષાપુર (કર્ણાટક) તા.૩ જિલ્લામાં મચ્છરોમાં ઘાતક છકા વાયરસ હોવાનું બહાર આવતા કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજયના ૬૮ અલગ અલગ સ્થળો પર મચ્છરોના શરીરમાં જીકા વાયરસની હાજરીનો ટેસ્ટ કરાયો હતો. આ જ રીતે ચિકકાબક્ષાપુર જિક્ષાના ૬ સ્થળોએથી સેમ્પલ લેવામાં આવેલ. જીકા વાયરસ સિદલાઘટ્ટા તાલુકાના તાલાકાયાલાબેટ્ટા ગામના મચ્છરોમાં મળી આવ્યા હતા. જેને લઈને સ્વાસ્થ્ય અધિકારીઓ તરત જ કાર્યવાહીમાં લાગી ગયા અને વાયરસના ફેલાવાને રોકવા માટે નિવારક ઉપાય શરૂ કરી દીધા. સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી પહેલા જ ખાસ બેઠકો આયોજીત થઈ ચૂકી છે.

અધિકારીઓએ ૩૦ ગર્ભવતી મહિલાઓ અને તાવના લક્ષણોવાળા ૭ વ્યક્તિઓના બ્લડના સેમ્પલો એકત્ર રિઝર્વમાં સોનાનો ઉમેરો કરી રહી કરાયા છે તેને પરીક્ષણ માટે બેંગ્લુરુ છે. ચીને તેના ગોલ્ડ રિઝર્વમાં ૧૮૧ મોકલાયા છે.

NOTICE

નીચે જણાવેલ વ્યક્તિઓને આથી જાણ કરવામાં આવે છે કે તેઓ લોન ખાતાઓમ **૪વાબદારીઓ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે, ૨જીસ્ટર પોસ્ટ દ્વારા તેમને મોકલવામાં આવેલી** નોટીસ બેંકની વિપરીત કર્યા વિના પરત કરવામાં આવી છે આથી તેમને જવાબદારી અને અન્ય શુલ્ક ચૂકવવા અને તારીખ ૬/૧૧/૨૦૨૩ ના રોજ અથવા તે પહેલા ગીરવે મૂકેલી સિક્યુરીટીસને રીડીમ કરવા વિનંતી કરવામાં આવે છે, જે નિષ્ફળ જાય તો બેંક દ્વારા જાહેર હરાજી બેંકની જગ્યામાં ઉદ્યારકર્તા ના ખર્ચે ઉપરોક્ત સિક્યુરીટીસ વેચવામાં આવશે. તારીખ ७/૧૧/૨૦૨૩ ના રોજ સાંજે ૪.૩૦ વાગ્યા સુધી અથવા તે પછીની કોઇપણ અન્ય અનુકૂળ તારીએ બેંકના સંપૂર્ણ વિવેકબદ્ભથી વધુ સુચના વિના ફરાજીની તારીખ અને સમય પાછી

동거	લોન એકાઉન્ટ	બ્રાન્થ નામ	ઉદ્યારકર્તાનું નામ	Liability
٩	41005632316	ડ્રાઇવન રોડ	ચુનીલાલ અમૃતલાલ કલાલ	110714.00

	FOR THE QUARTER EN						s. in Lakhs)
Sr. No	Particulars	Quarter ended on 30-09-2023 Unaudited	Quarter ended on 30-06-2023 Unaudited	Quarter ended on 30-09-2022 Unaudited	Half Year ended on 30-09-2023 Unaudited	Half Year ended on 30-09-2022 Unaudited	Year ended on 31-03-2023 Audited
1 2 3 4 5 6 7	Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per Share (Face Value of Rs.10/- each) Basic & Diluted	16.78 -6.12 -6.12 -40.00 -	10.06 10.01 8.01 40.00	-3.6 -6.28 -6.28 -40.00	26.84 3.89 1.89 40.00	-0.38 -3.71 -3.71 40.00	19.37 7.74 5.74 - 40.00 -

ARDI INVESTMENT & TRADING CO. LIMITED CIN: L65923MH1981PLC024912

પ્રદર્શન ભરપૂર વૃદ્ધિની સંભાવના સાથે દેશના સૌથી Notes: (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meeting held on 02-11-2023 (2) The Company's business activity fall within a singa primary business segment. (3) Previous year's figures are re-grouped, re-classified wherever necessary. For and on behalf of Ardi Investment and Trading Co. Limited sd/- Gautam P. Sheth, Managing Director- DIN: 06748854 Place : Mumbai || Date : 02/11/2023

પહોં ચવાની

ધારણા છે, એમ

પ્રકાશ પવારે

જણાવ્યું હતું.

ઉઘાે ગમાં

ભરપૂર

DEEP INDUSTRIES LIMITED

Regi. Office: 12 A &14, Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058. Ph: 02717-298510 Fax: 02717-298520 Email: cs@deepindustries.com www.deepindustries.com CIN:L14292GJ2006PLC049371

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE **QUARTER & HALF YEAR ENDED ON SEPTEMBER 30, 2023** (₹ In Lakhs)

Sr.	Particulars	Quarter Ended	Half Year Ended	Quarter Ended
No.	i urtiodiui o	30.09.2023	30.09.2023	30.09.2022
	(Refer Notes below)	Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operations (net)	11,098.22	21,790.72	6,848.33
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,793.64	7,587.83	1,417.31
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,793.64	7,689.33	1,417.31
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,952.33	6,053.99	860.22
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)	3,111.14	6,229.10	1,655.27
	for the period (after tax) and Other Comprehensive Income (after tax)]			
6	Equity Share Capital (Face Value of ₹. 10/- Per Share)	3,200.00	3,200.00	3,200.00
	Other Equity		2	
7	Earning per share of ₹. 10/- each			
	(from Continuing and Discontinuing Operations)			
	Basic (in ₹.)	4.61	9.46	1.34
	Diluted (in ₹.)	4.61	9.46	1.34
	KEY NUMBERS OF STANDALONE FINANCIAL RESULTS			
1	Total Income from Operations (net)	9,577.93	19,031.66	7,030.74
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,205.09	6,360.04	2,276.46
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	2,398.43	4,759.35	1,721.40

Notes:

- The above is an extract of the detailed format of quarter and half year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results for the quarter and half Year ended September 30, 2023 are available on the Stock Exchnage website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (http://www.deepindustries.com).
- The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on November 02, 2023. The statutory auditors of the company have carried out audit of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015
- Figures of previous reporting periods have been regrouped/reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.

PARAS SAVLA Place : Ahmedabad Date: 02-11-2023

Chairman & Managing Director (DIN: 00145639)

વિશ્વની મધ્યસ્થ બેંકોએ નવ માસમાં ૮૦૦ ટન સં મુંબઈ તા.૩ ટનનો વધારો વર્ષ દરમ્યાન કર્યો છે થશે તો સોનાની માંગ પણ વધશે તેવી શકયતા છે.

છેલ્લા એક વર્ષ કે વધુ સમયથી અને ચીનની મધ્યસ્થ બેંક પાસે ચાલી રહેલા યુક્રેન અને રશિયાના ૨૧૯૨ ટન સોનુ છે. કવાર્ટર-ટુ ના યુદ્ધ તેમજ હાલમાં ઈઝરાયેલ તથા ધીમા પરિણામોં પછી સોનાની ું હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે ખરીદીમાં વધારો થયો છે. ફકત વિશ્વભરમાં સલામતીની ચિંતા જાગી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જ ૩૩૭ ટન સોન છે અને ખાસ કરીને આર્થિક સલામતી ખરીદાયુ છે અને જૂન કવાર્ટર કરતાં માટે દુનિયાભરની મધ્યસ્થ બેંકો હવે ડબલ રહ્યું છે. વિશ્વની મધ્યસ્થ બેંકે સોનું ખરીદવા લાગી છે. જેમાં ચીન, ૨૦૨૨માં કુલ ૧૧૩૬ ટન સોનુ સિંગાપોર અને પોલેન્ડ એ સૌથી ખરીદ્યુ હતું. ભારતમાં સોનાનો ઉંચા મોટા ખરીદદાર જાહેર થયા છે. ધ ભાવ છતાં પણ સપ્ટેમ્બર કવાર્ટરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ સોનાની માંગ વધી હતી. હજુ પણ મુજબ ચાલુ વર્ષે જાન્યુ. થી સપ્ટેમ્બર સુધીમાં અનેક દેશોની હમાસ-ઈઝરાયેલના સંઘર્ષમાં વધારો કેન્દ્રીય બેન્કોએ કુલ ૮૦૦ ટન સોનુ ખરીદ્યુ છે. અમેરિકા અને યુરોપના

OSBI NOTICE

The following persons who have availed loans against pledge of gold ornaments have not repaid the amount in spite of our demand notices. Therefore, please take notice that if the principal/interest and other charges are not paid on or before 07/11/2023 the pledged ornaments will be publicly auctioned on 07/11/2023 at 4:30 p.m. in the Bank's premises subject to rules and regulations of the Bank. The Bank reserves the right to cancel/postpone the auction to any other convenient date without further notice and assigning reasons

S.	Gold Loan	BRANCH	Name Of the	Liability	
No.	Account	Name	Borrower		
1	41005632316	Drive In Road Branch	CHUNILAL AMRITLAL KALAL	110714.00	

RAGHUVIR SYNTHETICS LIMITED Regd. Office: Rakhial Road, Rakhial, Ahmedabad-380023

Phone: 079-22911015-22911902 • CIN: L17119GJ1982PLC005424 E-mail: info@raghuvir.com • Website: www.raghuvir.com

EXTRACT OF CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2023

TOR THE QUILCIER BRIDER OF SELFEMENT, 2020						
	(R	Rs. In Lacs exce	pt per share data)			
Particulars	Current Quarter Ending	Year to Date	Corresponding 3 months ended in the previous year			
	30-Sep-23	30-Sep-23	30-Sep-22			
Total Income from Operations	5614.83	11521.88	683.95			
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	89.28	13.14	(420.19)			
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	89.28	13.14	(420.19)			
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	75.68	(10.28)	(507.71)			
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	77.52	(10.27)	(505.80)			
Equity Share Capital	387.50	387.50	387.50			
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balace Sheet of the previous Year						
Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations) 1) Basic : 2) Diluted :	0.20 0.20	(0.02) (0.02)	(1.31) (1.31)			

Key numbers of Standalone Results are as under:

Particulars	Current Quarter Ending	Year to Date	Corresponding 3 months ended in the previous year	
	30-Sep-23	30-Sep-23	30-Sep-22	
Total Income from Operations	5612.15	11518.76	683.95	
Profit / (Loss) Before Tax	90.44	19.19	(420.06)	
Profit / (Loss) After Tax	76.85	(4.23)	(507.58)	
	300	77		

The above is an extract of the detailed format of Consolidated Un-audited Financial Results for the Quarter 30/09/2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Consolidated and Standalone Un-audited Financial Results is available on the website of the Stock Exchange www.bseindia.com and on the Company website at www.raghuvir.com.

Figures of the previous quarter / period / year have been regrouped or rearranged, wherever For, Raghuvir Synthetics Limited

Date: 03-11-2023 Sunil R. Agarwal Place: Ahmedabad (Chairman & Managing Director) DIN No.: 00265303

FEDERAL BANK

ફેડરલ બેંક લિમીટેડ

LCRD/મુંબઈ વિભાગ, ૧૩૪, તેરમો માળ, જોલી મેકર ચેમ્બર્સ નં. ૨, નરીમન પોઈન્ટ, મુંબઈ - ૪૦૦૦૨૧. ઈમेલ : mumlcrd@federalbank.co.in, ફોન નં.: ૦૨૨-૨૨૦૨૨૫૪૮, ૦૨૨-૨૨૦૨૮૪૨૦

1) શ્રી પ્રજાપતિ રમેશભાઈ નાગરભાઈ @ રમેશભાઈ નાગરભાઈ પ્રજાપતિ, 5/૦ નાગરભાઈ જીવાભાઈ પ્રજાપતિ

૪૧. યોગેશ્વર બેગ્લોઝ, ગુલાબ ટાવર રોડ, થલ તેજ, દસકોઈ, અમદાવાદ, ગુજરાત, ૩૮૦૦૫૯ 2) શ્રીમતી પ્રજાપતિ ઉર્મિલાબેન રમેશભાઈ @ ઉર્મિલાબેન રમેશભાઈ પ્રજાપતિ. W/o રમેશભાઈ નાગરભાઈ પ્રજાપતિ

૪૧. યોગેશ્વર બંગ્લોઝ, ગુલાબ ટાવર રોડ, થલ તેજ, દસક્રોઈ, અમદાવાદ, ગુજરાત, ૩૮૦૦૫૯ સિકયોરિટાઈઝેશન એન્ડ રીકન્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરીટી ઈન્ટરેસ્ટ એકટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) હેઠળ નોટીસ જારી કરવામાં આવી છે. (ત્યારબાદ એકટ તરીકે ઓળખવામાં આવે છે)

તમારામાંથી ૧લાએ મુખ્ય ઉધારલેનાર તરીકે બીજા જામીનદાર/સહ-અરજદાર/સહ-ઉધારકર્તા/મોર્ગેજર તરીકે છો ફેડરલ એગ્રી મોબાઇલ ટર્મ લોન ન. ૨૨૭૩૬૬૦૦૦૦૦૦૩૧ ની **રૂા. ૯,૪૦,૦૦૦/- (રૂા. નવ લાખ ચાલીસ હજાર પુરા) તા. ૩૦.૧૨.૨૦૧૬** ના રોજ ફેડરલ બેંક લિમીટેડ તરફથી વિતરીત કરવામાં આવી હતી જે કંપની એક્ટ હેઠળ નોંધાયેલ બેકીંગ કંપની છે અને તેની **અમદાવાદ/ એસ જી હાઇવે શાખા** ખાતે અલુવા ખાતે નોધાયેલ ઓફિસ (ત્યારબાદ બેંક તરીકે ઓળખાય છે) જરૂરી સિકયોરીટી કરારો/ લોન દસ્તાવેજોમાં અમલ કર્યા પછી વાહન ખરીદવા માટે

બેંક પાસેથી મેળવેલ ઉપરોક્ત ધિરાણ સુવિધાઓની સુરક્ષા માટે, તમારામાંથી ૧લીએ નીચેની જંગમ અને / અથવા સ્થાવર મિલકતના સંદર્ભમાં પૂર્વધારણા દ્રારા બેંકની તરફેણમાં સુરક્ષા રસ ઉભો કર્યો છે.

તારણમાં મુકેલ જંગમ મિલકતનું વર્ણન

Hypothecation of Hyundai Verna FL CRDI 1.6 S, White Colour, having Chassis No. MALCU41ULGM216668, Engine No. D4FBGM092488, 2016 Model, Diesel, Registration No. GJ 01 RW 0327.

ઉપરોક્ત અનુમાનિત સુરક્ષા ગુણધર્મોને પછીથી સુરક્ષીત સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમે સંમત શરતોનું ઉલ્લંઘન કરીને ઉપરોક્ત - સુરક્ષીત દેવું ચૂકવવામાં ડિફોલ્ટ થયા છો અને આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ **તા. ૧૪.૧૦.૨૦૨૩** ના રોજ ખાતું નોન પરફોર્મિંગ એસેટ બની ગયુ છે. નીચે સહીકરનાર ફ્રેડરલ બેંક લિમીટેડના અધિકૃત અધિકારી છે આથી તમને જણાવેલ કુલ રકમ **રૂા. ૩,૦૪,૮૦**૫/-**(રૂપિયા ત્રણ લાખ ચાર હજાર આઠસો અને માત્ર એક પુરા) તા**. ૧૮.૧૦.૨૦૨૩ રોજ તમારી પાસેથી સંયુક્ત રીતે અને વ્યક્તિગત રીતે ફેડરલ એગ્રી મોબાઇલ ટર્મ લોન હેઠળ લોન નં. સ્રગ્૩૬૬૦૦૦૦૦૦૩૧ બેંકની અમદાવાદ/ એસ જી હાઇવે શાખામાં લોન લીધેલ છે.

આથી અધિનિયમની કલમ ૨(zd) હેઠળ પરિક્પના કરાયેલા સુરક્ષીત લેણદાર તરીકે બેંક તમને આ અધિનિયમની કલમ ૧૩(૨) હેઠળ વિચાણા મુજબ, તેના પર 9.૯૦ % વધુ વ્યાજ સાથે ઉપરોક્ત ફેડરલ એગ્રી મોબાઇલ ટર્મ લોન સાથે તા. ૩૦.૦૯.૨૦૨૩ ના રોજ થી વધારાના ચાર્જિસ અને કિંમત સાથેની રકમ ચૂકવવા જણાવેલ છે ચુકવણીની તારીખ અને ખર્ચ / અન્ય શુલ્ક આ નોટીસની તારીખથી ૬૦ દિવસની અંદર, જો નિષ્ફળ જાય તો બેંક સુક્ષીત લેણદાર તરીકે, તેના કોઈપણ અન્ય અધિકારો અને ઉપાયો પ્રત્યે પૂર્વગ્રહ રાખયા વિના, કોઈપણ વધુ સૂચના વિના, તમારી સામે અધુનિયમની કલમ ૧૩(૪) હેઠળ સુચીત નીચે જણાવેલ પગલાં લેવા માટે પ્રતિબંધીત રહેશે.

- ઉપરોક્ત વર્ણવેલ સુરક્ષીત અસ્કયામતોનો કબજો લેવા અને બાકીની રકમની વસુલાત માટે લીઝ, સોંપણી અથવા વેચાણ દ્વારા ઉકત સંપત્તિઓને સ્થાનાંતરીત કરવા.
- સુરક્ષીત અસ્કયામતોનું સંચાલન હાથમાં લેવુ અને બાકી રકમની વસુલાત માટે લીઝ, સોંપણી અથવા વેચાણ દ્વારા તેમને સ્થાનાંતરીત
- બેંક દ્રારા કબજો લેવામાં આવેલ સુકક્ષીત સંપત્તિઓનું સંચાલન કરવા માટે કોઈપણ વ્યક્તિની નિમણૂક કરવી. કોઈપણ સમયે લેખિતમાં નોટીસ દ્રારા, કોઈપણ વ્યક્તિ કે જેણે તમારી પાસેથી કોઈપણ સુરક્ષીત સંપત્તિ મેળવી હોય અને જેની પાસેથી
- કોઈપણ નાણાં બાકી હોય અથવા બાકી હોય, બેંકને ચૂકવવા માટે જરૂરી છે. તમને એ પણ સૂચના આપવામાં આવે છે કે અધિનિયમની કલમ ૧૩(૧૩) ની મુજબ, તમે આ નોટીસની પ્રાપ્તી પછી વેચાણ, લીઝ અથવા

બન્યથા આ નોટીસમોં ઉલ્લેખીત કોઈપણ સુરક્ષીત મિલકતો કોઈપણ રીતે કોઈપણ રીતે ટ્રાન્સફર કરી શકશો નહી. તેની પૂર્વ લેખિત સંમતિ વિના બેંકના વ્યાજનો પર્વગ્રહ.

તમને કાયદાના સેક્શન ૧૩(૬) તરફ ધ્યાન દોરવામાં આવે છે જે દ્વારા બેંકની સિકયોર્ડ અસ્કયામતની તબદીલી જે આવી સિકયોર્ડ પ્રસ્કયામતના માલિક દ્વારા જે રીતે જે કે વ્યક્તિ (ટ્રાન્સફરી) ને કરવામાં આવી હોય તે વ્યક્તિને તબદીલી માટે માન્ય ટાઈટલના તમામ અધિકારો આપવાનો, અથવા એનાં સંદર્ભમાં આપવા માટે તે રીતના અધિકાર આપે છે. મહેરબાની કરીને જાણી લેજો કે તમારી જવાબદારી આ નોટીસની તારીખ થી દિન ૬૦ માં પુરેપુરી અદા કરવામાં કસુર કરવાની સ્થિતીમાં અને બેંક કાયદાની જોગવાઇઓ હેઠળ પગલાં લેવા શરૂ કરે તે સમયમાં તમે બેંકને તમામ કોસ્ટ, ચાર્જીસ અને આ સંદર્ભમાં ખથાર તમામ ખર્ચ આપવામાં બંધાયેલા છો. તમને કાયદાના સેકશન ૧૩(૮) ની જોગવાઈ તરફ પણ ધ્યાન દોરવામાં આવે છે જેમાં સિકયોર્ડ અસ્ક્યામતો (સિકયોરીટી મિલકતનો) છોડાવવાની સમય મર્યાદા જણાવેલ છે. જો સિકયોર્ડ અસ્કયામતોના વેચાણથી પણ લેણું પુરે પુરુ વસુલ નહીં થાય, તો બેંક બાકીની રકમની વસુલાત માટે વ્યકિતગત રીતે તમારી સામે કાર્યવાહી કરશે. આ નોટીસ બેંકને એના લેણાંની વસુલી કરવા માટે મળેલ અન્ય અધિકારો અને ઉકેલના પૂર્વગ્રહવિના મોકલેલ છે.

સહા/-અધિકૃત અધિકારી, ધી ફેડરલ બેંક લિમીટડ તારીખ : ૨૦.૧૦.૨૦૨૩